

**:— આંક — ૧ હેઠળ હુકમ —:**

(૧) હાલની અરજી અરજદાર **પાલ અમિત વિજયકુમાર નાઓએ** બી.એન.એસ.એસ. કલમ—૪૮૭ તથા ૫૦૩ મુજબ ફોડની રકમ પરત મેળવવા માટે હાલની અરજી કરેલી છે. આ કામે કેસની ટુંકી હકિકત એવી છે કે અરજદારના નીચે મુજબના ખાતામાંથી રકમ ફોડથી વિડ્રો થયેલ છે અને અરજદાર સાયબર ફોડ વિભાગમાં ફરીયાદ કરતા ટીકીટ નં. ૩૧૧૦૪૨૫૦૦૭૨૫૭૮ થી નોંધવામાં આવેલ અને તેના આધારે સામાવાળાના નીચે મુજબના ખાતામાં આ રકમ ફીઝ કરવામાં આવેલી છે.

| અરજદારના ખાતાની વિગત                                                    | સામાવાળાના ખાતાની વિગત                                          |
|-------------------------------------------------------------------------|-----------------------------------------------------------------|
| (1) <b>IDBI Bank</b> નાં ખાતા નં. 0130102000043449 માંથી રૂ. 19330.15/- | (1) <b>HDFC Bank</b> ના ખાતા નં. 50200074348486 માં રૂ. 19330/- |

આમ, અરજદારે ઉપરોક્ત ફિઝ કરવામાં આવેલ રકમ હાલની અરજી દ્વારા પરત માંગે છે જે અંગે **પોલીસ ઈન્સ્પેક્ટર, નવરંગપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર**નો અભિપ્રાય મંગાવતા તેઓએ અભિપ્રાય મોકલી આપેલ છે કે, અરજદાર સાઈબર ક્રાઈમનો ભોગ બનેલ હોય અને સામાવાળાનું ઉપરોક્ત ખાતું ફિઝ કરવામાં આવેલ છે અને તેમાં રહેલી અને ફિઝ થયેલી રકમ અરજદારને સુપરત કરવામાં આવે તો વાંધો નથી. વિશેષમાં ત.ક.અધિકારીએ જણાવેલ છે કે સામાવાળાનું ખાતું બનાવટી હોવાનું જણાઈ આવે છે કારણ કે સદરહુ ખાતું સીઝ કર્યા બાદ ખાતેદાર કે અન્ય કોઈ વ્યક્તિએ ખાતું સીઝ કર્યા બાબત પોલીસ સમક્ષ કોઈ વાંધા—તકરાર લીધેલ નથી. આમ, ત.ક.અધિકારીના અભિપ્રાય ને ધ્યાને રાખતાં જે ખાતામાં ફોડની રકમ ગયેલ છે તે ખાતું ફિઝ કરવા છતાં તે અંગે કોઈ ખાતેદારે વાંધો ઉઠાવેલ હોય તેવું જણાય આવતું નથી. જેથી માનવાને કારણ રહે છે કે, આ ખાતા ફોડ કરવા માટે જ ખોલાવવામાં આવેલ હશે અને પોતાનું ફોડ પકડાઈ ન જાય તે માટે ખાતું સીઝ કરવા છતાં ખાતેદારે પોલીસનો સંપર્ક કરેલ નથી જે પ્રથમદર્શનીય રીતે જણાય છે કે આ ખાતું ફોડ માટે જ ઓપન કરવામાં આવેલ હશે જેથી આ ખાતામાં ફિઝ થયેલી રકમ અરજદારના ખાતામાંથી ફોડ દ્વારા ટ્રાન્સફર થયેલ હોવાથી તે રકમ અરજદારના ખાતામાં પુનઃ ટ્રાન્સફર કરવી જરૂરી છે અને તે રકમ અરજદારને તે રીતે પરત કરવી ન્યાયી અને યોગ્ય જણાય છે જેથી આ અરજી હેઠળ નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

**:: હુકમ ::**

૧. સામાવાળાનું ઉપરોક્ત નંબરના ખાતા અને તેમાં રહેલી રકમો સાયબર ક્રાઈમ દ્વારા સીઝ કરી તેમાં રહેલ રકમ ફિઝ કરવામાં આવે છે જે ખાતાની બેલેન્સ રકમ રૂ. 19330/- જે ખાતામાં પેન્ડીંગ છે તે રકમ અરજદારના **IDBI Bank** નાં ખાતા નં. 0130102000043449 માં ટ્રાન્સફર કરવા માટે સંબંધિત બેન્કના બેન્ક મેનેજરને આદેશ કરવામાં આવે છે.

૨. સામાવાળાનુ ઉપરોક્ત ખાતા ફ્રિઝ કરેલ હોવાથી અરજદારના ખાતામાં ઉપરોક્ત રકમ ટ્રાન્સફર કરવા પુરતા આ ખાતા એક્ટીવ કરવા અને ઉપરોક્ત રકમ અરજદારના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા બાદ આ ખાતા કાયમી માટે કલોઝ કરવાનો આદેશ **સંબંધિત બેન્કને** કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં આ ખાતા ધ્વારા અન્ય લોકોની સાથે ફ્રોઝ કરવામાં આવે નહિ.

૩. આ હુકમની અમલવારી કરવા માટે **પોલીસ ઈન્સ્પેક્ટર, નવરંગપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર**નાઓએ અરજદાર તથા સામાવાળાની બેંક સાથે સંકલનમાં રહી હુકમની અમલવારી કરવી.

હુકમ આજરોજ તારીખ ૦૩ મી, માહે. મે, સને- ૨૦૨૫ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી મારી સહી કરીને જાહેર કર્યો.

તા.૦૩-૦૫-૨૦૨૫  
અમદાવાદ શહેર.

ઈ.ચા.ફદ્દા એડી. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ  
અમદાવાદ શહેર.